

(૧) પ્રેસનોટ

જેતપુર પ્રોહીના બુટલેગરને દેશીદારૂના જથ્થા સાથે બે ઇસમને પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય *એલ.સી.બી

રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણા સાહેબનાઓની સુચના અન્વયે એલ.સી.બી. ને લગતી કામગીરીમાં હતા તે દરમ્યાન એલ.સી.બી.રાજકોટ ગ્રામ્ય ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી જે.એમ.ચાવડા સાહેબ ના માર્ગદર્શન પો.સબ.ઇન્સ.શ્રી અ.એ.એ.જાડેજા સાહેબ , HC અનીલભાઈ ગુજરાતી , PC દિવ્યેશભાઈ સુવા જેતપુર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમિયાન ખાનગી બાતમી રાહે હકીકત મળેલ કે જેતપુર ખીરસરા રોડ પાસે એક સીલાવર કલર ની અલ્ટો કાર નં.GJ01KF7193 વાળી કાર માં (૧) હરસુખ @ દાસ ગોવિંદભાઈ સાહીયા (૨) સુરેશ @ વિઠલ ભોજાભાઈ ચાવડા રહે બંને જેતપુર નરસંગટેકરી (૩) કાળા દેવાયતભાઈ મોરી રહે.જુનાગઢ વાળા ઓ પાસે થી ઉપરોક્ત કાર સાથે નં.(૧)(૨) પાસે થી દેશીદારૂ ના બાયકા નંગ.૧૭ દેશીદારૂ લી.૫૦૦ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા અલ્ટો કાર ની કિ.રૂ.૧,૦૦,૦૦૦/- તથા મોબાઈલ મળી કુલ મુદામાલ કિ.રૂ.૧,૧૦,૫૦૦/- સાથે પકડી પાડી જેતપુર સીટી પોલીસ સ્ટેશને ગુનો રજુ કરાવી આગળ ની કાર્યવાહી કરેલ.

(૨) પ્રેસનોટ

દેશી દારૂ લીટર ૧૦૫ સાથે બે ઇસમોને પકડી પાડતી જેતપુર તાલુકા પોલીસ

રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મિણા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એમ.ભરવાડ સાહેબ જેતપુર વિભાગનાઓ તરફથી દારૂ તથા જુગારની બદીને સંપૂર્ણ રીતે નેસ્તનાબુદ કરવા આપેલ સુચના અન્વયે જેતપુર તાલુકાના પો.સબ.ઇન્સ. પી.જે બાંટવા તથા પોલીસ સ્ટાફના માણસો નાઇટ રાઉન્ડમાં હતાં તે દરમ્યાન મળેલ હકીકત ના આધારે ખારચિયા ગામ પાસેથી (૧) ધર્મન્દ્ર ભનુભાઈ પીપળીયા ઉ.વ. ૨૭ રહે. કરિયા ગામ તા. ભેસાણ (૨) મનીશ ભનુભાઈ જીલીયા ઉ.વ. ૨૮ રહે પસવારા તા. ભેસાણ વાડાઓને દેશી દારૂ લીટર ૧૦૫ કી.રૂ. ૨૧૦૦ તથા મો.સા. રજી નં. જી.જે.૧૧ બી.ઈ. ૯૫૬૯ કી રૂ , ૨૦,૦૦૦/- ના સાથે પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ.

આ કામગીરીમાં પો.સ.ઈ. પી.જે.બાંટવા તથા એ.એસ.આઇ. એમ.કે.મનાત તથા પો.હેડ. કોન્સ ભુપેન્દ્રભાઈ મોરી વિગેરે સ્ટાફ ના જોડાયા હતા.

(૩) પ્રેસ નોટ

તા. ૨૬/૧૧/૨૦૧૮ પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ ની સૂચનાથી તેમજ ના.પો. અધિ. શ્રી એચ.એમ જાડેજા સાહેબ તથા ગોંડલ સીટી પો.સ્ટે. ના પો.ઇન્સ. શ્રી કે.એન. રામાનુજ સાહેબના માર્ગદર્શન હેઠળ ગોંડલ સીટી પો.સ્ટે. ના પ્રોહી. ગુરનં. ૫૭૬/૨૦૧૮ નો ગુન્હો ગઇ તા. ૨૫/૧૧/૨૦૧૮ ના રોજ જાહેર થયેલ હોય જેની તપાસ પો.હેડ.કોન્સ. રાજેન્દ્રસિંહ ડી. ઝાલા ચલાવતા હોય અને તપાસ દરમ્યાન આરોપી ચિરાગ કાળુભાઈ સરવૈયા રહે. કપુરીયા પરા શેરી નં. ૩, ગોંડલ વાળાના રહેણાંક મકાનેથી પો.સબ.ઇન્સ. શ્રી બી.એલ.ઝાલા સાહેબ તથા પો.હેડ.કોન્સ. રાજેન્દ્રસિંહ ઝાલા તથા પો.કોન્સ. પ્રતિપાલસિંહ જેઠવા તથા પો.કોન્સ. રાજેશભાઈ બાયલનાઓએ તપાસ દરમ્યાન વધુ ભારતીય બનાવટનો પરપ્રાતીય ઈંગ્લિશ દારૂની બોટલ નંગ-180 કી.રૂ. 54000/- નો પકડી પાડી આરોપી વિરુદ્ધ ગોંડલ સીટી પો.સ્ટે. મા અલગથી ગુન્હો રજુ કરાવેલ છે. આ કામની આગળની તપાસ પો.હેડ.કોન્સ. રાજેન્દ્રસિંહ ડી. ઝાલા ચલાવી રહ્યા

(૪)પ્રેસનોટ

રબારીકા ગામની સીમમાંથી દારુ ગાળવાની ભઠ્ઠી પકડી પાડતી વિરપુર (જલારામ) પોલીસ

મ્હે પોલીસ અધિક્ષકશ્રી રાજકોટ ગ્રામ્ય બલરામ મીણા સાહેબ ની સુચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે એમ ભરવાડ સાહેબ જેતપુર વિભાગ તથા સી.પી.આઇ કે.આર.રાવત સાહેબ નાઓની પ્રોહી-જુગાર કેશો શોધી દારુ જુગાર પ્રવૃત્તી સંદંતર નાબુત કરવા સુચના આપેલ હોઇ જે સુચન આધારે વિરપુર પો.સ્ટેના પો.સબ.ઇન્સ શ્રી વી.બી.ચૌહાણ સા નાઓને મળેલ બાતમીના આધારે પો.સબ.ઇન્સ વી. બી. ચૌહાણ સા. તથા પો.હેડકોન્સ ભરતભાઇ કોચરા પો.હેડકોન્સ ભોળાભાઈ ગોહેલ એલ.આર.ડી. જયેશકુમાર ચાવડા ડ્રા.પી.સી અરવિંદસિંહ ગોહીલ એમ બધા રબારીકા ગામની સીમમાં રેડ કરી દેશી દારુની ભઠ્ઠી પકડી પાડી દેશી દારુ બનાવવાનો ગરમ તથા ઠંડો આથો લીટર ૩૬૦ તથા તૈયાર દેશી દારુ લીટર ૩૦ લીટર તથા ભઠ્ઠીના સાધનો પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરેલ છે જેમા આરોપી (૧) કિશોરભાઇ વરદાનભાઇ લાલુ કાઠી દરબાર ઉવ.૨૬ રહે.હાલ વિરપુર મુળ રે.રબારીકા તા.જેતપુર (૨) ભાભલુભાઇ ગભરુભાઇ જડુ કાઠી દરબાર રહે.હાલ વિરપુર મુળ રે.રબારીકા તા.જેતપુર વાળાઓ વિરુધ્ધ વિરપુર પોલીસ સ્ટેશને ગુન્હો રજુ કરાવેલ છે

ઉપરોક્ત કામગીરી વિરપુર (જલારામ) પો.સ્ટે ના પો.સબ.ઇન્સ શ્રી વી.બી.ચૌહાણ તથા UHC ભરતભાઈ કોચરા તથા UHC ભોળાભાઈ ગોહેલ તથા LRD જયેશકુમાર ચાવડા ડ્રા.PC અરવિંદસિંહ ગોહીલ વિગેરે રોકાયેલા હતા